

# ASEAN-India Foreign Ministers' Meeting and other related meetings

## ASEAN-ભારત વિદેશ મંત્રીઓની મીટિંગ અને અન્ય સંબંધિત મીટિંગો

05 ઓગસ્ટ, 2022

વાર્ષિક ASEAN-ભારત વિદેશ મંત્રીઓની મીટિંગ (AIFMM) માં હાજરી આપવા માટે ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 03-05 ઓગસ્ટ 2022 સુધી કમ્બોડિયાની મુલાકાત લીધી હતી. કમ્બોડિયામાં ફ્નોમ પેન્ડમાં 04 ઓગસ્ટ 2022 નાં બપોર બાદ AIFMM યોજવામાં આવી હતી. તેની સહ-અધ્યક્ષતા ભારતનાં વિદેશ મંત્રી અને સિંગાપોરનાં વિદેશ મંત્રી મહામહિમ ડૉ. વિવિયન બાલાક્રિષ્નન દ્વારા કરવામાં આવી હતી અને તેમાં અન્ય ASEAN સભ્ય રાષ્ટ્રોનાં વિદેશ મંત્રીઓ/પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

2. આ વર્ષે ASEAN-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠની યાદગીરીમાં જુન 2022 માં નવી દિલ્હીમાં ભારત દ્વારા યોજવામાં આવેલી વિશેષ ASEAN-ભારત વિદેશ મંત્રીઓની મીટિંગની તેઓની ચર્ચાઓને આગળ વધારતા, AIFMM માં મહામારી બાદનાં યુગમાં સ્માર્ટ કૃષિ, આરોગ્યસંભાળ, નવી અને રીન્યુએબલ એનર્જી, ડિજિટલ સમાવેશકતા અને ફિન્ટેકનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા સહિત ASEAN-ભારત સહકાર વધારવાનાં માર્ગો પર મનોમંથન કરવામાં આવ્યું હતું. મંત્રીઓએ પારસ્પરિક હિતનાં પ્રાંતિય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર ટ્રિપ્લિકોણોનું આદાનપ્રદાન પણ કર્યું હતું અને આગામી ASEAN-ભારત શિખર સંમેલન માટેની પૂર્વતૈયારીઓની ચર્ચા કરી હતી.

3. પોતાની ટિપ્પણીઓમાં, વિદેશ મંત્રીએ આ વર્ષે 'ASEAN એક્ટ: સાથે મળીને પડકારો સંબોધવા' વિષય અંતર્ગત કમ્બોડિયાની ASEAN અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી. તેઓએ ભારત દ્વારા ASEAN ને પ્રાંતિ., બહુપક્ષિય અને વૈશ્વિક ઓર્ડરનાં મહત્વનાં સ્તંભ તરીકે રાખવા પર પ્રકાશ પાડ્યો હતો. વિદેશ મંત્રીએ મૂક્ત, ઓપન, સમાવેશક અને નિયમ-આધારિત ઈન્ડો-પેસિફિકમાં ASEAN ની એકતા અને કેન્દ્રિયતા માટે ભારતનાં સમર્થનનું પુનઃઉચ્ચારણ કર્યું હતું. ઈન્ડો-પેસિફિક પર ASEAN આઉટલૂક (AOIP) અને ઈન્ડો-પેસિફિક સમુદ્રી પહેલ (IPOI) વચ્ચે પ્રબળ સંગમની નોંધ લેતા, તેઓએ ઈન્ડો-પેસિફિકમાં ભારત અને ASEAN વચ્ચે વધારે સહકાર માટે આલ્વાન કર્યું હતું. ASEAN વિદેશ મંત્રીઓએ ASEAN ને ભારતનાં સતત સમર્થનની પ્રશંસા કરી હતી અને ASEAN-ભારત સંબંધો વધારે મજબૂત કરવા સાથે મળીને કામ કરવા તરફ ટ્રિપ્લિકોણોને રાખે છે.

4. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી કમ્બોડિયાનાં વડાપ્રધાન મહામહિમ શ્રીમાન સુન સેનને પણ મળ્યા હતા અને પારસ્પરિક હિતનાં દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, યુએસ અને વિયેતનામનાં તેનાં સમતુલ્યો સાથે પણ દ્વિપક્ષીય સંવાદો કર્યા હતા.

5. ફ્નોમ પેન્ડની તેઓની મુલાકાત પૂર્વે, વિદેશ મંત્રી 03 ઓગસ્ટ 2022 નાં રોજ સિએમ ખાતે રોકાયા હતા જ્યાં તેઓએ તા પ્રોહમ મંદિર અને અંગકોર વાટ મંદિરનાં હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા આ સ્થળો પર કરવામાં આવેલા પુનઃસ્થાપન અને સંરક્ષણ કાર્યોની

તપાસ કરી હતી. તેઓએ સિએમ રીપમાં કમ્બોડિયા અને અન્ય MGC ભાગીદાર દેશો સાથે મળીને ભારત દ્વારા સ્થાપવામાં આવેલ મેકોંગ ગંગા કોઓપરેશન (MGC) એશિયન ટ્રેડિશનલ ટેક્સટાઇલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી અને આ પરિયોજના માટે ભારતનાં સતત સમર્થનની ખાતરી આપી હતી.

6. ફ્નોમ પેન્ડમાં ASEAN સંબંધિત મંત્રીઓની મીટિંગમાં 05 ઓગસ્ટ 2022 નાં રોજ 12મી પૂર્વ એશિયા શિખર સંમેલન વિદેશ મંત્રીઓની મીટિંગ અને 29મી ASEAN પ્રાંતિય મંચની મંત્રીઓની મીટિંગનો પણ સમાવેશ થતો હતો. સચિવ (પૂર્વ) દ્વારા આ મીટિંગોમાં ભારતીય પ્રતિનિધિ મંડળની આગેવાની કરવામાં આવી હતી. તેને ઉદ્ભવતા પડકારો સામે વધારે પ્રતિભાવક બનાવવા નેતાઓની આગેવાની ધરાવતા EAS મંચને મજબૂત બનાવવાનાં માર્ગો અને સ્ત્રોતોની ચર્ચા 12મી EAS માં કરવામાં આવી હતી. આ મીટિંગમાં પ્રાંતિય અને આંતરરાષ્ટ્રિય વિકાસો અને ભૂ-રાજકીય પડકારો પર ટ્રિપ્લિકોણોનું દાનપ્રદાન કરવામાં આવ્યું હતું તેમજ નવા EAS કાર્યવાહીની યોજના માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. નવેમ્બર 2022 માં નિર્ધારિત આગામી 17માં EAS શિખર સંમેલન માટેની પૂર્વતૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.

7. 29માં ASEAN પ્રાંતિય મંચ (ARF) માં આંતરરાષ્ટ્રિય અને પ્રાંતિય મુદ્દાઓ, તેમજ ARF નાં ભાવિ નિર્દેશનો પર ટ્રિપ્લિકોણોની આપલે કરવામાં આવી હતી. તેણે નિયંત્રણ પગલાઓ મારફત પ્રાંતમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો પ્રચાર કરવા પર ARF સ્ટેટમેન્ટ અને દક્ષિણપૂર્વ એશિયા પરમાણુ શસ્ત્રનાં નિયંત્રણ (SEANWFZ) પર ARF સ્ટેટમેન્ટ એમ બે સ્ટેટમેન્ટ્સ ગ્રહણ કર્યા હતા. ભારતનાં ARF સાથેનાં જોડાણનાં ભાગરૂપે, ભારત દ્વારા 12 મે 2022 નાં રોજ મેરિટાઇમ સુરક્ષા પર 13મી ARF આંતર-સત્રીય મીટિંગની સહ-અધ્યક્ષતા કરી હતી, અને વર્ષ 2022-2023 દરમિયાન આંતરરાષ્ટ્રિય જહાજ અને બૃદર સુવિધા સુરક્ષા સંહિતા (ISPS કોડ) પ્રતી વર્કશોપની શૃંખલાની સહ-અધ્યક્ષતા કરશે.

8. એકંદરે, વિદેશ મંત્રીની કમ્બોડિયાની મુલાકાત ફળદાયક રહી હતી અને ઈન્ડો-પેસિફિકમાં ભારતનાં દ્વિવપક્ષીય અને બહુવક્ષીય સંબંધોને મજબૂત કર્યા હતા.

**ફ્નોમ પેન્ડ**

**05 ઓગસ્ટ, 2022**

**DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.**